

વન રક્ષક ભરતી - ૨૦૧૬

શારીરિક ક્ષમતા કસોટી અંગેની સુચનાઓ

- લેખિત પરિક્ષાનું પરીણામ તા. ૦૪/૦૧/૨૦૧૭ ના રોજ (1) ઉત્તિર્ણ થયેલ (Qualified) યાદી-1 તથા (2) અનુત્તિર્ણ થયેલ (Not Qualified) યાદી- 2 તરીકે પ્રસિધ્ધ કરવામાં આવેલ હતું.
- ઉમેદવારો દ્વારા ફોન પર તથા ઇમેલ થી કરેલ રજૂઆતો /સમસ્યાઓ અંગે ઉચિત જવાબો / માર્ગદર્શન આપવામાં આવેલ.
- ઇ-મેલથી અથવા પત્રથી મળેલ લેખિત રજૂઆતો ને આધારે ઉત્તિર્ણ થયેલ ઉમેદવારોના કિસ્સામાં NCC / રમતગમત / વિધવાના પ્રમાણપત્રો ને ધ્યાનમાં લઈ માર્ક્સમાં યોગ્ય ફેરફાર કરવામાં આવેલ છે .
- આ સુધારા વધારાને ધ્યાનમાં રાખીને હવે દરેક જિલ્લાવાર અને કેટેગરીવાર નીચે પ્રમાણેની વિગતો આ સાથે પ્રસિધ્ધ કરવામાં આવે છે.

ઉત્તિર્ણ થયેલ ઉમેદવારોની સુધારેલ માર્ક્સ સાથેની જીલ્લાવાર યાદી <small>યાદી - ૧</small>
પ્રથમ તબક્કા ની શારીરિક ક્ષમતા કસોટી માટે જીલ્લાવાર / કેટેગરીવાર 'કટ ઓફ માર્ક્સ' યાદી - ૨
શારીરિક ક્ષમતા કસોટી માટે પ્રથમ તબક્કે બોલાવવામાં આવનાર જીલ્લાવાર / કેટેગરીવાર ઉમેદવારોની યાદી
શારીરિક ક્ષમતા કસોટી ના ધોરણો <small>યાદી - ૩</small>

સ્પષ્ટીકરણ

- લેખિત પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલ બીન અનામત આર્થિક પછાત વર્ગ (UEWS) ના ઉમેદવારોને જનરલ કેટેગરીના ઉમેદવાર તરીકે ધ્યાનમાં લઈ મેરીટ યાદી તૈયાર કરવામાં આવેલ છે.
- જે જિલ્લામાં SC/ST/SEBC કેટેગરીની જગ્યાઓ ન હોવા છતાં સંલગ્ન અનામત કેટેગરીના ઉમેદવારોને તે જિલ્લામાં જનરલ કેટેગરીના ઉમેદવાર તરીકે ધ્યાનમાં લઈ મેરીટ યાદી તૈયાર કરવામાં આવેલ છે.
- જે જિલ્લામાં જે તે કેટેગરીમાં મહિલાઓ માટે અલગ જગ્યાઓ નિયત થયેલ નથી તેવી ઉત્તિર્ણ થયેલ મહિલા ઉમેદવારોને જે તે જિલ્લાની જે તે કેટેગરી અથવા જનરલ કેટેગરીમાં સંયુક્ત મેરીટ લીસ્ટમાં સમાવેશ કરેલ છે.
- જે તે જિલ્લાની જે તે કેટેગરી માટે ભરવાની થતી કુલ જગ્યાઓના આઠ ગણા ઉમેદવારોને મેરીટના ધોરણે શારીરિક ક્ષમતા કસોટી માટે બોલાવવામાં આવનાર છે. જે તે સમાન કટ ઓફ માર્ક્સ ધરાવનાર તમામ ઉમેદવારોને શારીરિક ક્ષમતા કસોટી માટે ની યાદીમાં સમાવેશ કરેલ છે.
- ચાર ઝોન માં સમાવિષ્ટ જીલ્લાઓ માટેના ઉમેદવારો ની શારીરિક ક્ષમતા કસોટી તા. 12, 13 અને 14 ફેબ્રુઆરી 2017 ના રોજ નિયત થયેલ સ્થળ અને સમયે નિર્ધારિત થયેલ છે.

- જે તે ઉમેદવારને તેની ચોક્કસ તારીખ અને સમયની વિગતો વેબસાઇટ મારફતે અલગથી જાણ કરવામાં આવશે આવા શારીરિક કસોટી માટેની યાદીમાં પસંદગી પામેલ ઉમેદવારોને જે તે ઝોનના નિયત થયેલ સ્થળ ઉપર શારીરિક ક્ષમતા કસોટી માટે ઉપસ્થિત રહેવાનું રહેશે .
- શારીરિક ક્ષમતા કસોટી બાબતે કોઇપણ પુછપરછ માટે નીચેના નંબરો ઉપર સંપર્ક કરવાનો રહેશે.
- ઝોન માં સમાવિષ્ટ થયેલ જીલ્લા , સ્થળ તથા સંપર્ક અધિકારીની વિગતો નીચે પ્રમાણે છે:

ઝોન	ઝોનમાં સમાવિષ્ટ જિલ્લાનાં નામ	શારીરિક ક્ષમતા કસોટી માટેનું સ્થળ	જે તે ઝોન માટે સંપર્ક નંબર
ઉત્તર ગુજરાત ઝોન	કચ્છ, પાટણ, અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર	સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયાનું કેમ્પસ, સેક્ટર-૧૫, ગાંધીનગર	(1)નાયબ વન સંરક્ષકશ્રીની કચેરી, ગાંધીનગર વન વિભાગ (079) 23221 260 (2) નાયબ વન સંરક્ષકશ્રીની કચેરી,સામાજીક વનીકરણ, બનાસકાંઠા ,પાલનપુર (02742)257056
મધ્ય ગુજરાત ઝોન	વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, નડીયાદ, આણંદ, પંચમહાલ, મહિસાગર	એસ.આર.પી ગ્રાઉન્ડ, પંચામૃત ડેરી પાસે, ગોધરા	નાયબ વન સંરક્ષકશ્રીની કચેરી, ગોધરા વન વિભાગ, ગોધરા (02672)242210
દક્ષિણ ગુજરાત ઝોન	ડાંગ, વલસાડ, નવસારી, સુરત, તાપી, ભરૂચ, નર્મદા	પોલીસ પરેડ ગ્રાઉન્ડ, મુખ્ય મથક, સુરત ગ્રામ્ય (સુરત) ધલુડી, સુરત, તા.કામરેજ	નાયબ વન સંરક્ષકશ્રીની કચેરી, સામાજીક વનીકરણ, સુરત (0261) 2651 644
સૌરાષ્ટ્ર ઝોન	જુનાગઢ, ગીર સોમનાથ, જામનગર, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, દેવભૂમિ દ્રારકા, અમરેલી, પોરબંદર, મોરબી	પોલીસ પરેડ ગ્રાઉન્ડ, બિલ્ખા રોડ, જુનાગઢ	નાયબ વન સંરક્ષકશ્રીની કચેરી, ગીર પશ્ચિમ વન વિભાગ, જુનાગઢ (0285)2631044

ગાંધીનગર

તા.24/01/2017

સભ્ય સચિવ ભરતી સમિતિ

અને

મુખ્ય વન સંરક્ષક વહીવટ

ગુજરાત રાજ્ય, ગાંધીનગર

સંપર્ક નંબર - (079) 23254122,

E-mail:- apccf.fst.adm@gmail.com